

સાથના વિવિધ કાર્યક્રમો

રોજગારલક્ષી કાર્યક્રમો:

૧: વુમન ડેવેલોપમેન્ટ સેન્ટર:



- સમુદાયની વંચિત, પછાત, નબળી - દરેક ઉમરની મહિલાઓને ધ્યાન માં રાખીને આ કાર્યક્રમ જુહાપુરા વિસ્તારમાં શરૂ કર્યો.
- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને વિવિધ કોર્સ જેવા કે - કમ્પ્યુટરના, બ્યુટી પાર્લરના અને ઇંગ્લીશ સ્પીકિંગ વગેરેમાં જોડી, તાલીમ, માર્ગદર્શન અને પ્લેસમેન્ટ આપી તેમને સક્ષમ બનાવવાનો છે.
- આ કાર્યક્રમ દ્વારા કુલ ૯૭ મહિલાઓને તાલીમ આપવામાં આવી છે.

૨: ઉમ્મીદ, ઉડાન અને યુવા મસ્ત:



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા યુવાનો સ્વરોજગાર મેળવી શકે તેવી તાલીમ આપી, માર્કેટની જરૂરિયાત/ ડિમાન્ડને આધારિત ટ્રેનિંગ કાર્યક્રમ ચલાવવા અને જોબ પ્લેસમેન્ટ અપવવાનો છે.
- આ કાર્યક્રમ દ્વારા કુલ ૪૫,૦૮૦ યુવાનોને તાલીમ અને તે પૈકી ૭૬% યુવાનોને પ્લેસમેન્ટ દ્વારા જોબ અપાવવામાં આવી છે.
- ગુજરાતના ૧૩ અને રાજસ્થાનના ૯ સેન્ટરો આ કાર્યક્રમ માટે કાર્યરત છે.

૩: ઉર્મિલા - હોમ મેનેજર:



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઘરકામ કરવા જતા બહેનોની તાલીમ કરી ક્ષમતા વધારવી જેથી સ્વનિર્ભર બની વધારે આવક મેળવી શકે, પ્રોફેશનલ તાલીમ દ્વારા અસંગઠિતમાંથી સંગઠિત ક્ષેત્રમાં લાવી તેમનો વિકાસ કરવાનો છે.
- અત્યારે અમદાવાદ શહેરમાં આ કાર્યક્રમ ચાલે છે.
- આ કાર્યક્રમ દ્વારા કુલ ૮૮ મહિલાઓને તાલીમ આપવામાં આવી છે.

૪: આર-વીઝ:



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સુરેન્દ્રનગર જિલ્લાના કારીગરોને સપોર્ટ કરી ટાંગલિયા અને પટોળાની લુપ્ત થતી કલાને પુનર્જીવિત કરવાનો છે.
- આ કારીગરોને નાની લોન અપાવવી, નવી ડિઝાઇન અને પ્રોડક્ટનો વિકાસ કરવો, વર્કશોપ્સ અને પ્રદર્શનનું આયોજન કરવું અને કલાને પ્રોત્સાહિત કરવી તથા સ્થાનિક કારીગરોની કલાનું બ્રાન્ડીંગ અને માર્કેટીંગ કરવું.
- આ કાર્યક્રમ દ્વારા કુલ ૧૦ થી ૧૫ કારીગરોને સહાય કરી પ્રોડક્ટનું માર્કેટિંગ કરીએ છીએ.

૫: નિર્માણ:



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રના અસંગઠિત કામદારો જેવા કે કડિયા, સુથારી, ઈલેક્ટ્રીશીયન અને પ્લમ્બીંગ - તાલીમ આપીને તેમના કૌશલ્યોમાં વધારો કરવો જેથી તેમની આવકમાં વધારો થઈ શકે અને નવી તકો ઉભી થાય.
- આ કાર્યક્રમ અમદાવાદના - વાસણા, બહેરામપુરા, મેઘાણીનગર અને ઉસ્માનપુરામાં ૪ સેન્ટરો ચાલે છે.
- આ કાર્યક્રમ દ્વારા કુલ ૪૧૨ લોકોએ તાલીમ પુરી કરેલ છે તથા ૧૧૫ લોકો હાલમાં તાલીમ લઈ રહ્યા છે.

૬: યુથ ફોર્સ:



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મોટા શહેરોના સ્લમ વિસ્તારમાં રહેતા ૨૫,૦૦૦ યુવાનોને આ કાર્યક્રમમાં જોડી, તાલીમ આપી, પ્લેસમેન્ટ કરાવી, રોજગાર મેળવવામાં મદદ કરવાનો છે.
- અત્યારે આ કાર્યક્રમ ગુજરાતના અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ અને મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં કાર્યરત છે.
- આ કાર્યક્રમ દ્વારા કુલ ૩૦૦ સભ્યોને આવરી લેતા ૯ યુથ ગ્રુપની રચના કરવામાં સફળતા મેળવી છે.

શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો:

૭: ચાઈલ્ડ ફ્રેન્ડલી સ્પેસીસ:



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મજુરીકામમાં જોડાયેલા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું, પૂરક પોષણ મળે તેવો આહાર આપવો અને તેમને બાળમજુરીમાંથી બહાર લાવી મુખ્ય શિક્ષણના પ્રવાહમાં શામેલ કરવાનો છે.
- અત્યારે અમદાવાદ શહેરના સ્લમ વિસ્તારમાં - ૩ અને બાંધકામની સાઈટ પર - ૪ એવી રીતે કુલ ૭ સેન્ટર ચાલે છે.
- આ કાર્યક્રમ દ્વારા કુલ ૨૩૯ બાળકોને તાલિમ આપવામાં આવી છે.

૮: બાલધર:



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ૩ થી ૬ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ લેવા તૈયાર કરવા, તેમના આરોગ્ય તપાસ કરી પુરક પોષણ આપવું, મોન્ટેસરી પદ્ધતિ પ્રમાણે પ્રવૃત્તિ કરવી, ગુણવત્તાવાળું શિક્ષણ આપી બાળકોને સર્વાંગી વિકાસ કરવાનો છે.
- અત્યારે અમદાવાદ શહેરના જુહાપુરાના સ્લમ વિસ્તારમાં આ કાર્યક્રમ ચાલે છે.
- આ કાર્યક્રમ દ્વારા કુલ ૨૬૧ બાળકોને તાલીમ આપવામાં આવી છે.

ગવર્નન્સલક્ષી કાર્યક્રમો:

૯: અર્બન રિસોર્સ સેન્ટર:



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવું સેન્ટર બનાવવાનો હતો કે જ્યાંથી સ્લમ વિસ્તારના રહેવાસીઓ બધા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકે, તેમના જ્ઞાનમાં વધારો થાય, જરૂરી પ્રમાણપત્રો/ દસ્તાવેજો મેળવવામાં મદદ થાય, જુદી-જુદી સરકારી યોજનાઓની જાણકારી-લાભ લેવામાં સરળતા થાય અને એડવોકેસી/ સમજણ દ્વારા પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરવાનો છે.
- અત્યારે અમદાવાદ શહેરના-વાસણા, જુહાપુરા, અને બહેરામપુરાના સ્લમ વિસ્તારમાં અને રાજકોટ શહેરમાં કાર્યરત છે.
- આ કાર્યક્રમ દ્વારા કુલ ૨૭,૦૦૦ કુટુંબો સુધી પહોંચ પ્રસ્થાપિત કરવાનું અને ૬,૨૨૮ લોકોની સાથે જોડાણ શક્ય બન્યું છે

માનવ અધિકારલક્ષી કાર્યક્રમો:

૧૦: ચાઈલ્ડ રાઈટ્સ ફોર ચેન્જ:



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધોળકા અને વિરમગામ તાલુકાના ૧૨૦ ગામમાં કપાસના ખેતરોમાં કામ કરતા બાળમજૂરોને શિક્ષણમાં પાછા લાવી – શાળામાં દાખલ કરવાનો છે.
- આ કાર્યક્રમ દ્વારા મુખ્યત્વે બાળકોના રક્ષણ, ભણતર, સ્ત્રીઓનાં રોજગાર અને આરોગ્ય નિવારણ પર વધુ ધ્યાન અપાય છે.
- આ કાર્યક્રમ દ્વારા કુલ ૮૪૦૦૦ બાળકોને ૪ વર્ષમાં ફાયદો મળેલ છે.

આવાસલક્ષી કાર્યક્રમો:

૧૧: અફોર્ડેબલ હાઉસીંગ – ગૃહ પ્રવેશ:



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડી.બી.એસ. અફોર્ડેબલ હાઉસીંગ સાથે જોડાઈને ઓછી તથા મધ્યમ આવક ધરાવતા લોકને પોતાનું ઘર બનાવવામાં સક્ષમ કરવાનું, તેઓને ફાઈનાન્સ મેળવવા માટે મદદરૂપ થવાનું અને ઘરના દસ્તાવેજો વિષે જ્ઞાન આપવાનું છે.
- આ કાર્યક્રમ અમદાવાદ અને સુરત શહેરમાં ચાલે છે.
- આ કાર્યક્રમ દ્વારા ૨૩,૦૦૦ લોકો સુધી પહોંચી શક્યા છીએ અને લગભગ ૧,૦૦૦ લોકોને મેમ્બર તરીકે જોડી શક્યા છીએ.

પુનર્વસવાટ અને પુન:પ્રસ્થાપનલક્ષી કાર્યક્રમો:

૧૨: ઈ.ડબલ્યુ.એસ (ઈકોનોમિકલી વિકર સેક્શન) હાઉસીંગ સાઈટ:



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હાઉસીંગ કો-ઓપરેટીવ બનાવી – લોકોની ભાગીદારી ઉભી કરવી તથા શિક્ષણ, આરોગ્ય, લાઈટ, પાણી, સાફ-સફાઈ, બચત અને ધિરાણ જેવી પ્રવૃત્તિઓ ચલાવવાનો છે.
- આ કાર્યક્રમ અમદાવાદના ૮ વિસ્તારોમાં ચાલે છે જેવા કે વટવા, ઓઢવ, ઇસનપુર, દુધેશ્વર, બહેરામપુરા વગેરે
- આ કાર્યક્રમ દ્વારા ૬,૧૨૦ કુટુંબોના ૩૦,૬૦૦ વ્યક્તિઓને લાભ આપવામાં આવેલ છે.

બચત અને ધિરાણલક્ષી કાર્યક્રમો:

૧૩: સાથ બચત અને ધિરાણ સહકારી મંડળી લિ.તથા સાથ મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી લિ. :



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમુદાયના લોકોમાં અને ખાસ સ્ત્રીઓમાં બચતની ટેવ પાડવા માટે, બચત અને ધિરાણ પ્રવૃત્તિ કરવી, નાણાકિય શિક્ષણ અને આયોજનનું મહત્વ સમજાવવું, કો-ઓપરેટીવનું કાર્યક્ષેત્ર વધારવું, નાના ઉદ્યોગ-ધંધા કરતા ક્લાઈન્ટને બિઝનેસની સ્કીલ્સ આપવી – ધંધાના વિકાસમાં સપોર્ટ કરવાનો અને સભાસદોના ધંધાકીય વિકાસ માટે આવડત વધારવા તાલીમ આપવાનો છે.
- આ કાર્યક્રમ અમદાવાદના સ્લમ વિસ્તારોમાં તેમ જ ધોળકા અને વિરમગામ તાલુકાના ૭૨ ગામોમાં કાર્યરત છે.
- આ કાર્યક્રમ દ્વારા કુલ ૨૦,૭૯૭ સ્લમ વિસ્તારના અને ૨૪,૦૦૦ જેવા ગામના લોકો જોડાયેલા છે.

રિસર્ચ અને ડોક્યુમેન્ટલક્ષી કાર્યક્રમો:

૧૪: રિસર્ચ ડોક્યુમેન્ટેશન અને કમ્યુનિકેશન સેલ:



- આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સાથમાં આવતા દરેક મુલાકાતીઓ, ઈન્ટર્નસ, વિઝીટર્સ અને વોલેન્ટિયર્સ ને સૌ પ્રથમ સાથની ઓળખ આપવી, તેમના કાર્યમાં મદદ કરવી અને ડોક્યુમેન્ટેશન, રિપોર્ટિંગ અને ડિઝાઈનિંગનું કામ કરવાનો છે.
- સાથની ઓળખાણ મીડિયા અને સોશયલ નેટવર્કિંગ દ્વારા વ્યાપ વધરવા માટે કો-ઓર્ડિનેશન કરવાનું કાર્ય કરે છે.
- આ કાર્યક્રમ દ્વારા જુદા જુદા દેશના (જેવા કે નેધરલેન્ડ ફાન્સ હોંગકોંગ અને અમેરિકા) કુલ ૩૨ વોલેન્ટિયર્સ ને સહયોગ પ્રદાન કર્યો છે.